

September 5, 2025

To,  
BSE Limited  
PhirozeJeejebhoy Towers,  
Dalal Street,  
Mumbai – 400001  
Script Code: **517571**

To,  
NSE Limited  
Exchange Plaza, Plot No.C/1  
Bandra- Kurla Complex  
Bandra (East), Mumbai 400051  
NSE Symbol: **INDLMETER**

**Sub: Newspaper Advertisement for 63<sup>rd</sup> Annual General Meeting and E-voting information.**

Dear Sir/Madam,

Please find attached herewith the copies of newspaper advertisement published on September 5, 2025, in 'Financial Express (English Newspaper), and 'Daman Ganga Times' (Gujarati Newspaper), regarding the 63<sup>rd</sup> Annual General Meeting to be held on Friday, 26<sup>th</sup> day of September, 2025 at 12:30 p.m. through Video Conferencing/ Other Audio Visual Means, e-voting information and other related information.

The newspaper clippings are attached for your information and records.

You are Requested to take the note of the same.

Thanking you,

Yours faithfully,

**For, IMP Powers Limited**

Shaishav  
Rakeshkumar  
Shah

Digitally signed by  
Shaishav Rakeshkumar  
Shah  
Date: 2025.09.05 12:46:10  
+05'30'

**Shaishav Shah**  
**Director**  
**DIN: 00019293**

**Registered Office:** Survey No. 263/3/2/2, Village Sayli, Umar Kuin Road, Silvassa, Dadra & Nagar Haveli - 396 230

Office: CH-7, Inspire Business Park, Shantigram, SG Highway, Ahmedabad – 382 421

☎ +91-0260- 2464100 / +91-79-26554100 | ✉ [info@imp-powers.com](mailto:info@imp-powers.com) | 🌐 [www.imp-powers.com](http://www.imp-powers.com)

CIN: L31300DN1961PLC000232



#### CHANGE OF NAME

OLD NAME: RUDRA YOGESH PATEL,  
MOTHER'S NAME: PRIYANKA YOGESH PATEL,  
NEW NAME: RUDRA YOGESH PATEL,  
MOTHER'S NAME: PRIYANKA SURESHBHAI  
VADIWALA  
ADDRESS: HOUSE NO.117, DEVKA  
BHANDARWAD, NANI DAMAN – 396210.

#### ચુનિફોસ ઇન્ટરનેશનલ લિમિટેડ

CIN: U24219GU1992PLC027317

રજી. ઓફિસ ૧૦૧૧ એ, સોનોરસ- એ, ૧૦ મો માળ, મહાત્મા ગાંધી સર્કલ પાસે, સર્વિટ હાઉસની સામે, રેલ્વે સ્ટેશન રોડ, વાપી, વલસાડ, ગુજરાત - ૩૯૬૧૧૧

વેબસાઇટ : [www.uilonline.com](http://www.uilonline.com) ઇમેઇલ : [uail@uilonline.com](mailto:uail@uilonline.com)

#### નોટીસ

આથી જાણ કરવામાં આવે છે કે, કંપનીના કાયદો, ૨૦૧૩ ની કલમ ૧૦૮ અન્વયે અને તેના હેઠળ બનાવવામાં આવેલા નિયમો મુજબ કંપનીએ સભ્યોની ૩૩ મી વાર્ષિક સામાન્ય સભા સોમવાર, ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ૧૧, જી. આઇ. ડી. સી., વાપી, ગુજરાત-૩૯૬૧૧૫ ખાતે સવારે ૯.૦૦ વાગ્યે યોજાશે છે. કંપનીએ ૩૩ મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં જણાવેલ કામકાજ બાબત રિમોટ ઈ મતદાન સુવિધા નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એન એસ ડી એલ) દ્વારા પુરી પાડી છે જેની લિંક <http://www.evoting.nsdl.com>.

આ રિમોટ ઈ મતદાનનો સમય શુક્રવાર તા.૨૬મી સપ્ટેમ્બર, ૨૦૨૫ સવારે ૯.૦૦ વાગ્યે થી શરૂ થઇને રવિવાર તા.૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે સમાપ્ત થશે. આ પછી એન એસ ડી એલ દ્વારા આ રિમોટ ઇ વોટિંગનું મોડ્યુલ મતદાન માટે બંધ કરવામાં આવશે.

રિમોટ ઇ વોટિંગ દ્વારા મતદાનનો ઉપયોગ કર્યા પછી પણ સભ્ય ૩૩મી વાર્ષિક સામાન્ય સભામાં હાજર રહી શકે છે. પરંતુ ફરીથી મતદાન માટે હકદાર રહેશે નહિ.

રિમોટ ઈ વોટિંગ બાબતમાં કોઇપણ પુછપરછ હોય તો તેઓ ઇમેઇલ દ્વારા એન એસ ડી એલને [evoting@nsdl.co.in](mailto:evoting@nsdl.co.in) અથવા ટેલિફોન નં (ટોલ ફ્રી) ૧૮૦૦-૨૨૨-૮૮૦ ઉપર સંપર્ક કરવો.

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના આદેશથી

સહિ

બિપિન જાની

ડાયરેક્ટર

તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૫

(સિન : ૦૦૨૯૭૦૩૩)

#### જાહેર હરાજી

આથી જાહેર જનતાને જણાવવાનું કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ડાંગ સંચાલિત વાંઘદા પ્રાથમિક શાળા, તા. આહવા જી.ડાંગના નળિયાવાળા એક(૧) અને પતરાવાળા એક (૧) એમ કુલ બે (૨) જુના ઓરડાની જાહેર હરાજી તારીખ : ૧૨/૦૮/૨૦૨૫ને શુક્રવારના દિને ૧૨:૩૦ કલાકે રાખવામાં આવેલ છે, તો તમામને હરાજીમાં ભાગ લેવા વિનંતી.

**નોંધ :** હરાજીની શરતો સ્થળ ઉપર વાંચી સંભળાવવામાં આવશે.

હરાજીનું સ્થળ SMC અધ્યક્ષ તથા મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા વાંઘદા પ્રાથમિક શાળા વાંઘદા તા.આહવા જી.ડાંગ પિન. ૩૯૪૧૭૦ તા.આહવા જી.ડાંગ

ક્રમાંક : માહિતી/ડાંગ/૧૧૨/૨૦૨૫

GUJARAT COTEX LIMITED

Regd. Office: Shop No. 4, 1st Floor, Shanti Complex, Opp. Patel Petrol Pump, Amli, Silvassa 396230, Contact No. +91 93279 77729 Email : [jayrajha@hotmail.com](mailto:jayrajha@hotmail.com), Website : [www.gujcotex.co](http://www.gujcotex.co) Corporate Identity Number : L46411DN1996PLC000116

**NOTICE OF ANNUAL GENERAL MEETING, RECORD DATE, BOOK CLOSURE AND EVOTING**

NOTICE IS HEREBY GIVEN that the Annual General Meeting (AGM) of Gujarat Cotex Limited will be held on Tuesday, 30th September, 2025, at the Hotel Southnagya Inn, Plot No. 116/31, Silvassa – Vapin Main Road, Amli, Silvassa 396230

The notice of the Meeting shall be emailed to members whose email address is available and has been sent to others by prescribed mode. The notice along with annual report has also been placed on website of the company.

Notice is further given that:

1. The business proposed in the notice of AGM may be transacted through voting by electronic means.
2. The e-voting shall commence on 27/09/2025 at 09.00 a.m.
3. The e-voting shall end on 29/09/2025 at 05.00 p.m.
4. The cut-off date for entitlement of e-voting shall be 23/09/2025.
5. Remote e-voting shall not be allowed beyond end of e-voting period.
6. The company is providing electronic voting facility from a place other than venue of AGM ("remote e-voting") provided by Central Depository Services (India) Limited (CDSL) to its members in respect of the business to be transacted at the ensuing AGM.
7. A member may participate in Annual General Meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting.
8. A person whose name is recorded in the register of members or in register of beneficial owners maintained by the depositories as on cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in general meeting.
9. The website address of the company is [www.gujcotex.co](http://www.gujcotex.co) and that of CDSL is [www.evotingindia.com](http://www.evotingindia.com).
10. The grievances connected with facility for e-voting by electronic means may be refer to Mr. Upal Shah, Regional Officer, Ahmedabad, CDSL, 203/204, Ashishree Avenue, 2nd floor, Near Nehru Nagar Circle, S. M. Road, Ambavadi, Ahmedabad - 380 015 at email: [upals@cslindia.com](mailto:upals@cslindia.com), Tel.: 079-32936232

NOTICE IS ALSO HEREBY GIVEN pursuant to Section 91 of the Companies Act, 2013 that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 24/09/2025 to 30/09/2025 (both days inclusive).

For Gujarat Cotex Limited

Shaileshkumar Jayankumar Parekh

(Managing Director)

(DIN: 01246270)

વાહન (બસ) ભાડે રાખવા અંગેની જાહેરાત

કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ પોલીટેકનીક, વઘઈ (ડાંગ) ખાતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગ રૂપે રાવે-ફીલ્ડટ્રીપ, કલ્ચરલ, રમત-ગમત, શૈક્ષણિક પ્રવાસ, તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને જવા-આવવા માટે ૫૬ સીટર બસ ભાડુતી વાહનની વર્ષ ૨૦૨૪-૨૬માં ભાડે રાખવા જરૂરિયાત હોય તો રસ ધરાવતી પાર્ટીઓ પાસે બસ ભાડે આપવા માટેના પ્રતિ કી.મી. અને એક દિવસના ઓછામાં ઓછા ગણવાપાત્ર કિલોમીટરના દર અંગેની કૃષિ મહાવિદ્યાલયને સીલબંધ કવરમાં તા.૧૯/૦૮/૨૦૨૫ સુધીમાં મળી જાય તે રીતે ટપાલ/કુરીયર મારફતે આચાર્યશ્રી, કૃષિ મહાવિદ્યાલય, નં.ફ.યુ., વઘઈ (ડાંગ)ને મોકલી આપવાના રહેશે. ભાવ ભરવા માટેની શરતો અને બોલીઓ યુનિવર્સિટીની વેબ સાઇટ [www.nau.in](http://www.nau.in) ઉપર મળી રહેશે.

સહી/- આચાર્ય

ક્રમાંક : માહિતી/ડાંગ/૧૧૧/૨૦૨૫

#### CHANGE OF NAME

I HAVE CHANGED MY NAME FROM OLD NAME :  
DAXESH MANUBHAI DESAI TO NEW NAME :  
DAKSHESHKUMAR MANUBHAI DESAI,  
RESIDENT OF 14-45/A-1/S-3,FLAT NO 203 DILIP  
EMPIRE,DILIP NAGAR,TIN  
BATTI,KATHIRIA,NANI DAMAN,DAMAN,DAMAN  
AND DIU-396210.

#### CHANGE OF NAME

I HAVE CHANGED MY NAME RIYAZ AHMED IQBAL KHAN TO NEW RIYAZ AHMED KHAN AS PER DOCUMENTS

#### કાર્યપાલક મેજસ્ટ્રેટ અને મામલતદાર પારડીની કોર્ટમાં,

અરજદાર :- હિતેશભાઈ પીરુભાઈ પટેલ રહે. ૬/૩૦૪ બંધારી ફળિયા, પરીયા તા.પારડી

સામાવાળા :- તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયત ક્ષેત્રી પરીયા તા.પારડી, જી.વલસાડ

જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ ની કલમ-૧૩ (૩) અનુચ્છ મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અનુચ્છ નોટીસ

આથી લાગતા વળગતા ઈસમોને જણાવવાનું કે, અરજદારે જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ હેઠળ અરજ કરેલ છે કે, અરજદારશ્રી હિતેશભાઈ પીરુભાઈ પટેલ, રહે. ૬/૩૦૪ બંધારી ફળિયા પરીયા તા.પારડી જી.વલસાડનામે તેઓના માતા તારાબેન પીરુભાઈ પટેલનું મરણ તા.૧૫/૦૭/૧૯૮૩ ના રોજ મોજે- પરીયા તા.પારડી જી.વલસાડ મુકામે થયેલ છે. તેમના મરણની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભૂલ અને શરતચૂકથી કરવાની રહી ગયેલ છે. જેથી અંગેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર મરણની નોંધણી બાબતે કોર્ટને વાંધો થા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરજી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦ (ત્રીસ) દિવસની અંદર કાર્યપાલક મેજસ્ટ્રેટ અને મામલતદાર પારડી, મામલતદાર ક્ષેત્રી પારડી, તા.પારડી જી.વલસાડની નજરે અને વાંધા રજૂ કરવાના રહેશે. જો વાંધો નહીં આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા ઈસમોએ નોંધ લેવી.

આજ રોજ તા.૦૧/૦૮/૨૦૨૫ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

નં.એમ.એજ/જન્મ-મરણ/રજી નં.૧૧૧-૨૦૨૪/૨૦૨૫

કાર્યપાલક મેજસ્ટ્રેટ અને મામલતદાર ક્ષેત્રી, પારડી. તા.પારડી જી.વલસાડ

કોર્ટનો સિક્કો

સહી/- કાર્યપાલક મેજસ્ટ્રેટ પારડી

#### IMP IMP પાવર્સ લિમિટેડ

CIN : L31300DN1961PLC000232

રજિસ્ટર્ડ ઓફિસ : સર્વે નંબર 263/3/2, ગામ સાયલી, ઉમર કુર્બન રોડ, સિંઘવાસા, દાદરા અને નગર હવેલી - 396 230 ।

ઓફિસ : CH-7, ઈન્સ્પાયર બિઝનેસ પાર્ક, શાંતિશામ, એસજી. હાઈવે, અમદાવાદ - 382 421 । Tel. No. : +91-0260-2464100/ +91-79-2655 4100

Website : [www.imp-powers.com](http://www.imp-powers.com) । Email ID : [info@imp-powers.com](mailto:info@imp-powers.com)

#### વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોટિંગ માહિતીની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે IMP પાવર્સ લિમિટેડ (કંપની)ના સભ્યોની વાર્ષિક સામાન્ય સભા (AGM) શુક્રવાર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે વિડિઓ કોન્ફરન્સિંગ ("VC") અથવા અન્ય ઓરિજીનલ વિઝ્યુઅલ માધ્યમ ("OAVM") દ્વારા એક જ સ્થળે સભ્યોની પ્રત્યક્ષ હાજરી વગર કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) દ્વારા જારી કરાયેલ જનરલ સર્ક્યુલર નં. ૨/૨૦૨૦ તારીખ પ મે, ૨૦૨૦ હાલમાં જનરલ સર્ક્યુલર નં. ૦૮/૨૦૨૪ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ દ્વારા સુધારેલ અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ સેબી સર્ક્યુલર નં. SEBI/HO/CFD/CFO-POD-2/P/CIR/2024/1133 તારીખ ૩ એપ્રિલ, ૨૦૨૪ ના અનુવાદન હેઠળ AGM ની નોટિસમાં જણાવેલ કાર્યો પાર પાડવા યોજાશે. ઉપરાંત પરિપત્રોના પાલનમાં, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ (વાર્ષિક અહેવાલ) માટે વાર્ષિક સામાન્ય સભાની નોટિસ ઈલેક્ટ્રોનિક રીતે ૦૪-૦૮-૨૦૨૫ ના રોજ તે સભ્યોને મોકલવાનું પૂર્ણ થયું છે જેમના ઈમેઇલ આઈડી કંપની / રિપોઝિટરીમાં નોંધાયેલા છે. વધુમાં, કંપનીએ ૦૪-૦૮-૨૦૨૫ ના રોજ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમન ૩૬(૧)(બી) અનુસાર, જે સભ્યોના ઈમેઇલ સરનામાં કંપની / RTA / રિપોઝિટરી સહભાગી(ઓ) સાથે નોંધાયેલા નથી તેમને વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫ (નોટિસ સહિત) એક્સેસ કરવાના માર્ગ સાથે વેબ-લિંક ધરાવતી પત્ર મોકલવાનું પણ પૂર્ણ કર્યું છે. વાર્ષિક સામાન્ય સભાની નોટિસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ [www.imp-powers.com](http://www.imp-powers.com) પર, સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE લિસ્ટિંગ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિસ્ટિંગની વેબસાઇટ અનુક્રમે [www.bseindia.com](http://www.bseindia.com) અને [www.nseindia.com](http://www.nseindia.com) પર અને MFUF ઈ-ટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (MFUF ઈ-ટાઇમ) (AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ સુવિધા અને ઈ-વોટિંગ સિસ્ટમ પ્રદાન કરવા માટેની RTA અને એજન્સી) ની વેબસાઇટ <https://instavote.linkintime.co.in/> પર પણ ઉપલબ્ધ છે.

કંપનીએ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ ("થ એક્ટ") અને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધા પુરી પાડી રહી છે જેથી તમામ સભ્યોએ એજન્સીની નોટિસમાં દર્શાવેલ તમામ કરારો જે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવતા, સમય સમય પર સુધારેલા, ઈન્ટિસ્ટન્ટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય સભા પર જારી કરાયેલ સેક્ટરીઝલ સ્ટાન્ડર્ડ્સ - ૨ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ રિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ) ૨૦૧૫ ના નિયમ ૪૪ ના પાલનમાં, કંપની AGM દરમિયાન રિમોટ ઈ-વોટિ



## Pipeline Infrastructure Limited

CIN: U8030AM1281PLC308292

Registered Office: Seawoods Grand Central, Tower-1, 3<sup>rd</sup> Level, C Wing - 301 to 304, Sector 40, Seawoods Railway Station, Navi Mumbai, Thane, Maharashtra - 400706, India.  
Tel No.: +91 22 3501 8000; Email: compliance@pipelineinfra.com; Website: www.pipelineinfra.com

### NOTICE TO DEBENTUREHOLDERS RECORD DATE FOR PAYMENT OF INTEREST


Notice is hereby given that pursuant to the terms of 7.96% fully paid up, secured, rated, listed, redeemable non-convertible debentures in the denomination of Rs. 1,00,000/- each, issued and allotted by Pipeline Infrastructure Limited, on private placement basis, on March 11, 2024 and listed on the debt market segment of BSE Limited ("NCDs"), the Company has fixed 'Record Date' for determining the names of the NCD holders eligible to receive interest. The NCD holders whose names appear as Beneficial Owners on the Record Date as per the list furnished by the Depositories would be entitled to the said payment, as per the following details:

Sr. No.	Scrp Code	ISIN	Record Date	Interest	Date of payment of Interest
1	975482	INE1XX07059	Monday, September 15, 2025	Interest	Tuesday, September 30, 2025
2	975483	INE1XX07042	Monday, September 15, 2025	Interest	Tuesday, September 30, 2025
3	975484	INE1XX07034	Monday, September 15, 2025	Interest	Tuesday, September 30, 2025

For Pipeline Infrastructure Limited

Sd/-  
Suneta Mehta  
Company Secretary & Compliance Officer  
ACS 26206

Place: Navi Mumbai Date: September 4, 2025



ARM BRANCH - MUMBAI - Canara Bank, Building, 4<sup>th</sup> Floor, Adil Marzban Path, Ballard Estate, Mumbai - 400 001. Email: cb260@canarabank.com, TEL - 8655948019, WEB: www.canarabank.com

CERSA/SECURITY ID: 400073000872

### POSSESSION NOTICE (Section 13(4))

WHERE AS The undersigned being the Authorized Officer of Canara Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Enforcement) Act, 2002 (SARFAESI) and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 07.08.2024 calling upon the borrowers/guarantors to repay the amount mentioned in the notice, Rs. 27,34,268.60/- (Rupees Twenty Seven Lakhs Thirty Four Two Hundred Sixty Eight And Paise Sixty Only) within 60 days from the date of receipt of the said Notice. The Borrower/guarantors/mortgagors- Mr. Abubakar Usmani Gani Ansari S/o Usman Gani Ansari having failed to repay the amount, notice is hereby given to the borrower/guarantors/mortgagors and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under Sub-Section (4) of section 13 of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 30<sup>th</sup> day of Aug of year 2025.

The Borrowers attention is invited to the provision of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower and guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the CANARA BANK, ARM Branch for an amount of Rs. 30,58,504.20/- (Rupees Thirty Lakhs Fifty Eight Thousand Five Hundred Four Paise Twenty Only) as on 29.08.2025 and further interest & other charges from 30.08.2025 onwards.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY  
Residential Flat No. 002, Ground Floor, Admeasuring Area 421 Sq Ft (Carpet Area), Building No. 7-B In Housing Complex In Project "Shubhvastu", All That Piece And Parcel Of Plot Of N.A Land Bearing Plot 7, Survey /Gut No. 122, 123, 124, 125, 126, 127, 128, 131, 134, 140, 143a, 143b, 144, 146a, 146b, 147 Lyng And Being Situated At Village Khatival, Taluka Shapur, District Thane And Within The Limits Of Grampanchayat Khatival District-Thane, Sub District-Shapur, Date: 30.08.2025 Sd/-

Place: MUMBAI AUTHORIZED OFFICER, CANARA BANK

## SHRI GURUDEV EN-TRADE LIMITED

CIN : L2922AM1984PLC217693

Warden House, 340 J. J. Road, Byculla, Mumbai - 400 008.

PAN : AAHCS03030E | TEL : (91) 22 6996 7900

Website : www.shrigurudevtrade.com | Email : cosec@shrigurudevtrade.com

### NOTICE OF 41<sup>st</sup> ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that 41<sup>st</sup> Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Tuesday, 30<sup>th</sup> September 2025 at 2:00 p.m. at Warden House, 340 J. J. Road, Byculla, Mumbai - 400008 to transact the business as set out in Notice of 41<sup>st</sup> AGM.

Electronic copies of the Notice of the AGM and Annual Report for FY 2024-25 will be sent to all members today whose email IDs are registered with the Registrar and Share Transfer Agents/Depository Participant (s). These documents are also available on the website of the Company.

In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015 the Company is providing to its members, facility to cast their right to vote using an electronic voting system from a place other than venue of the meeting ("remote-e-voting") for all the business to be transacted at the 41<sup>st</sup> Annual General Meeting.

The e-voting shall commence on Saturday, 27<sup>th</sup> September 2025 at 9:00 a.m. and end on Monday, 29<sup>th</sup> September 2025 at 5:00 p.m. The "remote e-voting" facility shall not be allowed after the aforementioned date and time. The cut-off date to determine eligibility to cast votes by electronic means or at the 41<sup>st</sup> AGM of the Company is Tuesday, 23<sup>rd</sup> September 2025.

The Members who have not cast their votes by "remote e-voting" can exercise their voting rights at the 41<sup>st</sup> AGM. The Company will make arrangements for polling papers in this regard at the venue of 41<sup>st</sup> AGM. A Member may participate in the 41<sup>st</sup> AGM even after exercising his right to vote through "remote e-voting" but shall not be allowed to vote again at the 41<sup>st</sup> AGM.

Notice of 41<sup>st</sup> AGM is available on the website of the Company at [www.shrigurudevtrade.com](http://www.shrigurudevtrade.com) and also on the website of the Stock Exchange at [www.mseil.in](http://www.mseil.in). In case of any query pertaining to e-voting, please visit Help and FAQs for members and e-voting user manual for members available at [www.evotingindia.com](http://www.evotingindia.com), under help section or write email to [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com). Telephone No. 1800 21 09911.

Members who have not registered/updated their e-mail address with MUFUG Intime India Private Limited Registrar and Transfer Agent (RTA) of the Company may write to [mumbai@in.mpm.mufug.com](mailto:mumbai@in.mpm.mufug.com). If shares are held in physical mode or with their Depository Participants ("DPs"), if shares are held in electronic mode, for receiving all future communications from the Company including Annual Reports, Notices, Circulars, etc. electronically.

By Order of the Board

For Shri Gurudev En-Trade Limited

Shashi Kumar Dujari

Date : 5<sup>th</sup> September, 2025 Director (DIN : 00116132)

Place : Mumbai

### COURT ROOM NO.81TH IN THE COURT OF THE HON'BLE MUMBAI CITY CIVIL COURT MAZGAON AT MUMBAI,

Summary Suit No.100871 of 2023

[Order 5 Rule 20, (1-A) of CPC, 1908 for Publication]

Plaint lodged on : 03.04.2023 / Plaint admitted on : 04.09.2023  
Summons to answer Plaint Under Order XXXVII Rule 11 of the Code Civil Procedure 1908.

UNION BANK OF INDIA, Banking Company constituted under The Banking Companies (Acquisition & Transfer of Undertaking) Act, 1970; Having its Head Office at 239, Vidhan Bhavan Marg, Mumbai - 400 021 Having its Branch at, Home Street Branch Forbes Building, Charni Ravi Marg, Mumbai 400001, Maharashtra, Through Mr. Rajiv Kumar. Srivastava Senior Branch Manager, Ages about Years Occupation - Service. ...PLAINTIFF

Vs/-  
M/s. Jai Mata Di Tours & Travels, Mr. Jagjivan P. Prajapati (proprietor) Room No. 5, Ambashri Chawls, Vaghralpada, Vashi East, Near Bhoirpada, Rajival, Palghar - 401 208, Maharashtra. ...DEFENDANTS

Defendant Name / Above Name Defendants.

(As Per Order Dated on 24.07.2025 in presiding in court Room No.81TH Order Passed By H.J.J. SHRI. SANGRAM S. SHINDE)

Greetings: WHEREAS the above named Plaintiffs has/ have instituted a Suit in this Honorable Court against you above named Defendants's Under Order XXXVII Rule 11 of Code Civil Procedure 1908.

THE PLAINTIFF THEREFORE PRAYS:-

(a) That the defendant be decreed and ordered to pay to the plaintiff a sum Rs. 2,55,759.46/- (Rupees Two Lakh Fifty Five Thousand Seven Hundred Fifty Nine And Paise Forty-Six Only) as on 01.10.2022 inclusive interest as on 01.10.2022 with further interest @ 9.45% p.a. with monthly rests from 02.10.2022 till payment judgment & realization.

(b) This Hon'ble Court be pleased to fix a time within which the defendant be directed jointly and/or severally to pay the said dues amounts in terms of prayers (A) above, and in default, This Hon'ble Court be pleased to make an order of seizure and attachment of the said vehicle as described in of the defendants and order it to be sold by way of private treaty and/or public auction and proceeds thereof be made over to the plaintiff Bank in protanto satisfaction of its dues as may be certified in prayer (A) above.

(c) That in the event of deficiency on such sale and realizations personal decrees is passed against defendant to the extent of such deficiency.

(d) The defendant be directed to furnish a list in the form of an affidavit giving therein complete details of all his respective movable and immovable assets including Cash and Bank balances held by them either in his respective personal names and/or jointly and/or severally with others and file the same in this Hon'ble Court.

(e) This Hon'ble Court be pleased to make an order of attachment of all those movable properties of the defendants including cash and Bank balances and other receivables held by them either in his respective personal names and/or jointly severally with others to be furnished by the defendants in the form of an affidavit in terms of prayers above.

(f) That the defendants may be directed to pay to the plaintiff their costs of the suit.

(g) And for such other and further reliefs as the nature and circumstances of the case may require.

You are hereby summoned to cause an appearance to be entered for you. Within ten days of the service hereof, in default where of the Plaintiffs will be entitled at any time after the expiration of such ten days to obtain a decree for the sum of Rs. 2,55,759.46/- (Rupees Two Lakh Fifty Five Thousand Seven Hundred Fifty Nine And Paise Forty-Six Only) such Sum as prayed for and for costs, together with such interest, if any, as the Honorable Court may order.

If you cause an appearance to be entered for you, The Plaintiffs will thereafter serve upon you summons for judgment at hearing of which you will be entitled to ask the Honorable Court for leave to defend the suit.

Leave to defend may be obtained if you satisfy Honorable Court by affidavit or otherwise that there is a defense to suit on merits or that it is reasonable that you should be allowed to defend the suit.

Given under my hand and the seal of this Hon'ble Court Sd/-

Dated this 22nd day of September, 2025 For Registrar

City Civil Court, at Mumbai

ADVOCATE NAME:- KULADEEP C. SHUKLA

Advocate for the Plaintiff

Off: Flat No.-405, Sahakar, Apartment, Narayan Nagar, Nr. Modern, Opp. Mahanara Pratap Ground, Bhayander (W), Thane-4011011

Mobile No. 9769369002 / Email- isk44legal@gmail.com

You are hereby informed that the Legal Service from State legal Services from the State legal Services Authority, High Courts Services Committee, District Legal Services Authority and Taluka Legal Services Committee as per eligibility criteria are available to you and in case you are eligible and desire to avail the free legal services Authority/Committee.

N.B.-: A copy of the plaint along with all annexure thereto Clified as true by Advocate for Plaintiffs is/are enclosed herewith.

Advocate for Plaintiffs/ Signature  
Note: Next date in this suit is 09.09.2025 Please Check the status and next further date of this suit on the official website of City Civil & Session Court Mazgaon at Mumbai.



Registered Office: Unit Nos. 2050 to 2052, 2nd Floor, Plaza - II, Central Square, 20, Manohar Lal Khurana Marg, Bara Hindu Rao, Delhi - 110006

CIN: L74899DL1889PLC000004

Website: www.dcm.in, Email Id: investors@dcm.in, Tel No.: 011-41539170

### INFORMATION REGARDING 135TH ANNUAL GENERAL MEETING OF DCM LIMITED

In furtherance to our Notice published in the newspapers viz. Financial Express (English) and Jansatta (Hindi) on August 20, 2025 regarding the 135th Annual General Meeting ("AGM") of DCM Limited ("the Company") to be held on Tuesday, September 30, 2025 at 12:30 P.M. (IST) through Video Conferencing/ Other Audio Visual Means ("VC/OAVM"), the Members of Company are hereby informed that the Notice convening the AGM, procedure & instructions for e-voting ("remote e-voting" and "e-voting at the AGM") and the Annual Report for the financial year 2024-25 have been sent on September 04, 2025 to those Members whose e-mail id's are registered with the Company/Depository Participants ("DPs")/Registrar and Transfer Agent of the Company ("RTA"). Further, in accordance with Regulation 36(1)(b) of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 ("Listing Regulations"), a letter containing the weblink and exact path of the Notice of AGM and Annual Report for the financial year 2024-25 is being sent at the registered address of the Members whose e-mail addresses are not registered with the Company/RTA/DPs. The Members requiring the hard copy of the Annual report may send their request on [investors@dcm.in](mailto:investors@dcm.in).

Members may download the Notice of AGM, Annual Report for the financial year 2024-25 and other relevant documents from the website of the Company viz. [www.dcm.in](http://www.dcm.in); stock exchanges where shares of the Company are listed viz. BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com); National Stock Exchange of India Limited viz. [www.nseindia.com](http://www.nseindia.com) and National Securities Depository Limited ("NSDL") viz. [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com). The venue of the AGM shall be deemed to be the Registered Office of the Company.

The detailed procedure for attending AGM, e-voting ("remote e-voting" and "e-voting at the AGM") etc. is set forth in the Notice of AGM, on the following lines:

- The Company is providing facility to its Members to exercise their right to vote on the businesses set forth in the Notice of AGM through remote e-voting and e-voting at the AGM. Procedure for e-voting and attending the AGM for Members are provided in Notice of AGM. NSDL has been engaged by the Company for providing VC/OAVM platform and e-voting facility.
- The remote e-voting facility will be available during the following period:

Commencement of remote e-voting	From 9:00 A.M. (IST) on September 26, 2025 (Friday)
End of remote e-voting	Up to 5:00 P.M. (IST) on September 29, 2025 (Monday)

The remote e-voting facility will be forthwith disabled by NSDL and Members will not be allowed to vote through remote e-voting, beyond the said date and time.

- Members of the Company whose names are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date i.e. Monday, September 22, 2025 only, are entitled for e-voting and to attend the AGM. Once the vote on a resolution is cast by the Member, he/she shall not be allowed to change it subsequently. Voting rights of the Members shall be in proportion to their holding in the paid-up share capital of the Company as on the Cut-off date. Person who are not member as on Cut-off date should treat this notice for information purpose only.
- Members who have exercised their right to vote through remote e-voting may attend the AGM, but shall not be allowed to cast their vote again thereat.
- In case a person has become a Member of the Company after dispatch of the Notice but on or before the Cut-off date i.e. Monday, September 22, 2025 or has registered the e-mail address after dispatch of the Notice, such Member may obtain the User ID and Password in the manner outlined in the Notice of AGM.

- Manner of registering/updating email address:

- Members holding shares in physical form and who have not registered/ updated their KYC details including e-mail id with the Company or RTA, may register/ update such details by downloading the relevant forms from the said link <https://www.mcsregistrars.com/downloads.php> and sending the same physically along with the request letter duly filled with the details therein and attaching such documents as required in the forms to MCS Share Transfer Agent Limited, Unit: DCM Limited, 179-180, DSIDC Shed, 3rd Floor, Okhla Industrial Area, Phase-1, New Delhi-110020; and

- Members holding shares in dematerialized mode and have not registered/ updated their e-mail address, can register/update their email address with the DPs where they maintain their demat accounts.

- The result will be declared by the Chairman or any other person authorized by him on or before Thursday, October 02, 2025. The result along with the Scrutinizer's report will be hosted on the Company's website viz. [www.dcm.in](http://www.dcm.in) and on NSDL's website viz. [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com). The result shall also be intimated to the Stock Exchanges viz. BSE Limited and National Stock Exchange of India Limited, NSDL and Central Depository Services (India) Limited. The Company will also display the result at its Registered Office.

- In case of any query regarding e-voting facility, please refer Frequently Asked Questions (FAQs) and e-voting user manual for Shareholders available at the Download section at [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com) or send a request to Ms. Pallavi Mahatre, Senior Manager (NSDL) at [evoting@nsdl.com](mailto:evoting@nsdl.com) or can write at NSDL, 301, 3rd Floor, Naman Chambers, G Block, Plot No. C-32, Bandra Kurla Complex, Bandra East, Mumbai- 400051 or call at 022 - 4886 7000.

For DCM Limited

Sd/-

Arijit Gupta

Company Secretary

Place: Delhi

Date: 04.09.2025

## LANDMARC LEISURE FACILITY LIMITED

CIN: L65990MH1991PLC060535

Reg. Office: 303, Raaj Chamber, 115 R.K. Paramhans Marg, (Old Nagardas Road), Near Andheri Station Subway, Andheri - East, Mumbai-400 069.

Website : [www.llcl.co.in](http://www.llcl.co.in) | Email : [grievances@llcl.co.in](mailto:grievances@llcl.co.in) | Contact no: 022-61669190/91/92

### NOTICE TO MEMBERS

Notice is hereby given that, the 34<sup>th</sup> Annual General Meeting ("AGM") of the members of the company will be convened through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") in compliance with applicable provisions of the Companies Act 2013 and the rules notified thereunder, read with General Circular No. 14/2020 dated 08.08.2020, Circular No. 17/2020 dated 13.04.2020, Circular No. 20/2020 dated 05.05.2020, Circular No. 02/2021 dated 13.01.2021, Circular No. 2/2022 dated 05.05.2022, Circular No. 3/2022 dated 05.05.2022, Circular No. 10/2022 and Circular No. 11/2022 dated 28.12.2022, Circular No. 09/2023 dated 25.09.2023 and Pursuant to the Circular issued by Securities & Exchange Board of India ("SEBI Circular"), Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12.05.2020, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13.05.2022, Circular No. SEBI/HO/CFD/ PoD-2/CIR/2023/134 dated 05.01.2023 and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/CIR/2023/167 dated 07.10.2023 and all other relevant circulars issued from time to time.

The 34th AGM of the Company will be held on Tuesday, September 30, 2025 at 04:00 P.M. (IST), through VC/OAVM facility provided by Bgshare Services Pvt. Ltd. ("Bgshare"), Registrar and Transfer Agent of the company, to transact the business as set out in the Notice convening the AGM. The member can attend and participate in the AGM only through VC/OAVM as no provision has been made to attend the AGM in person. The attendance through VC/OAVM will be counted for the purpose of reckoning the quorum for the AGM.

In compliance with the MCA and SEBI Circular(s), the notice setting out the business to be transacted at the AGM together with the Annual Report of the company for the year 2024-25 will be sent electronically to those members whose email address is registered with the company/ Depository participant(s). No physical copies of the notice and the Annual Report would be sent to any member.

The Notice of the AGM and the Annual Report will also be available on the Company's website at <https://llcl.co.in/> and on the website of Stock Exchange i.e. BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com).

Manner of registering/ updating email address for receiving the documents pertaining to 34<sup>th</sup> AGM

Members may send an e-mail request addressed to [grievances@llcl.co.in](mailto:grievances@llcl.co.in) and [ajayparticipant@bgshareonline.com](mailto:ajayparticipant@bgshareonline.com) along with scanned copy of the request letter duly signed by the first shareholder, providing the email address, mobile number, self - attested copy of PAN and Client Master copy in case shares are held in electronic form or copy of the share certificate in case shares are held in physical form, to enable Bgshare to register their address and to provide them the Notice, Annual report and the e-voting instructions along with the user ID and Password.

Kindly note that in case the shares are held in electronic form, the above facility is only for temporary registration of email address for receipt of the Notice, Annual Report and the e-voting instructions along with the user ID and Password. Such members will have to register their email address with their Depository Participants permanently, so that all communications are received by them in electronic form.

Manner of casting vote(s) through e-voting

Members will have an opportunity to cast their vote(s) on the business as set out in the Notice of the AGM through remote e-voting facility ("remote e-voting"). The facility for e-voting will also be made available during the AGM to those members who could not cast their vote(s) by remote e-voting. The detailed procedure for e-voting before as well as during the AGM will be provided in the Notice of the AGM.

Members who do not receive email or whose email address is not registered with the Company/Depository Participant(s), may generate login credentials by following instructions given in the Notice of AGM. The same login credentials can also be used for attending the AGM through VC/OAVM.

Members are requested to carefully read all the notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM and manner of casting votes through e-voting. In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 and the rules made there under, as amended, read with SEBI (LODR) Regulations, 2015. The details of e-voting are as under:

- Date of Dispatch of Notice - September 03, 2025.
- The e-voting period begins on Saturday, September 27, 2025 at 10:00 A.M. and ends on Monday, September 29, 2025 at 5:00 P.M. During this period, shareholders of the Company holding shares as on the cut-off date i.e. Tuesday, September 23, 2025, may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL for voting thereafter.

- Any person who becomes member of the company after the cut-off date may apply for e-voting login id password as per procedure given in the ballot form which is available on [www.llcl.co.in](http://www.llcl.co.in) and [www.bseindia.com](http://www.bseindia.com).
- The result of the e-voting shall be declared by the director of the company on October 01, 2025.

- Members who have cast their vote by e-voting may attend the meeting but shall not be entitled to cast their vote again.
- Members who have not cast their vote through e-voting can vote in the meeting.

- Members may contact Mr. K R Mahadevan, Whole time Director, on 022-61669190 email at [grievances@llcl.co.in](mailto:grievances@llcl.co.in) for any grievances relating to e-voting.

Notice is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 and SEBI (LODR) Regulation that the Register of Members of the Company will be closed from Wednesday, September 24, 2025 to Friday, September 26, 2025 for the purpose of AGM.

For Landmarc Leisure Corporation Limited

Sd/-

Mahadevan Ramanathan Kavassery

Whole Time Director &amp; CFO

Place : Mumbai

Date: September 3, 2025

epaper.financialexpress.com

## FORM A PUBLIC ANNOUNCEMENT

(Under Regulation 6 of the Insolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)

### FOR THE ATTENTION OF THE CREDITORS OF QUADRANT TELEVENTURES LIMITED

#### RELEVANT PARTICULARS

3. Authority under which corporate debtor is incorporated / registered	ROC-Mumbai
4. Corporate Identity No. / Limited Liability Identification No. of corporate debtor	CIN: L00000MH1946PLC197474
5. Address of the registered office and principal office (if any) of corporate debtor	Registered Address: Flat no. 6, B-Type, Sadafuli Building, Trugul Park, Gunasahar Nagar, N-4, CIDCO, Aurangabad City, Aurangabad, Maharashtra, India- 431001 Address where books of accounts are maintained: B-71, Industrial Area Phase- VII, Mohali, Punjab, India- 160055
6. Insolvency commencement date in respect of corporate debtor	02/09/2025
7. Estimated date of closure of insolvency resolution process	1st March, 2026 (180 <sup>th</sup> day from the date of Commencement of Insolvency Resolution Process)
8. Name and registration number of the insolvency professional acting as interim resolution professional	Name: Atul Kumar Kansal Regd. No.: IBS/IMP/2011/P-00035/2016-2017/10088 AFA Valid Upto: 31.12.2025
9. Address and e-mail of the interim resolution professional, as registered with the Board	Ground Floor, 221-A/19, Onkar Nagar-B, Tri Nagar, North West, National Capital Territory of Delhi - 110035 Email: <a href="mailto:advatulkansal@gmail.com">advatulkansal@gmail.com</a>
10. Address and e-mail to be used for correspondence with the interim resolution professional	Immature Resolutions LLP, Unit No. 112, First Floor, Tower-A, Spazedge Commercial Complex, Sector-47, Sohna Road, Gurgaon-122018 Email Id: <a href="mailto:Qti.lbc@gmail.com">Qti.lbc@gmail.com</a>
11. Last date for submission of claims	16/09/2025
12. Classes of creditors, if any, under clause (b) of sub-section (84) of section 21, ascertained by the interim resolution professional	Not Applicable
13. Names of Insolvency Professionals identified to act as Authorised Representative of creditors in a class (Three names for each class)	Not Applicable
14. (a) Relevant Forms and (b) Details of authorized representatives are available at:	(a) <a href="https://ibbi.gov.in/en/home/downloads">https://ibbi.gov.in/en/home/downloads</a> (b) Not Applicable